

ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

:સુધારા યાદી:

વંચાણે લીધી:(1) આયોગની તા.14.08.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી

(2) આયોગની તા.12.10.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની બીજી યાદી

(3) આયોગની તા.28.12.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની ત્રીજી યાદી

(4) આયોગની તા.31.01.2018ની રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

1. આયોગ દ્વારા પ્રસિધ્ધ થયેલ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ઉદ્યોગ કમિશ્નરશ્રીની કચેરીના ઉદ્યોગ અધિકારી (તાંત્રિક) / મેનેજર (કા.મા.), વર્ગ-2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 127/2016-17ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.11.06.2017 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે તા.14.08.2017ના રોજ અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 20 ઉમેદવારો ના બેઠક નંબરોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

2. આ અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી પરના 20 ઉમેદવારોના બેઠક નંબરોની પાત્રતા ચકાસણી બાદ આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નિયત નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે પાત્ર પુરતા ઉમેદવારો ન મળતા લાયકી ધોરણ નીચું લઈ જઈ વધુ કુલ: 21 બેઠક નંબરોની બીજી યાદી તા.12.10.2017ના રોજ અરજી ચકાસણી માટે જાહેર કરવામાં આવેલ હતી.

3. આ 21 ઉમેદવારોના બેઠક નંબરોની પાત્રતા ચકાસણી બાદ પણ નિયત નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે પાત્ર પુરતા ઉમેદવારો ન મળતા લાયકી ધોરણ નીચું લઈ જઈ વધુ કુલ: 09 બેઠક નંબરોની ત્રીજી યાદી તા.28.12.2017ના રોજ અરજી ચકાસણી માટે જાહેર કરવામાં આવેલ હતી. ત્યારબાદ અરજી ચકાસણીને અંતે તા.31.01.2018ના રોજ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા 20 ઉમેદવારો ની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

4. આ જગ્યાની જાહેરાત તા.15.03.2017ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તથા તેમાં ઓન-લાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31.03.2017 નિયત થયેલ છે. આ જગ્યાની જાહેરાતની અનુભવ અંગેની જોગવાઈ અનુસાર, ઉમેદવાર “ (1) Have about three years' experience in the field of Engineering or Technology (excluding civil Engineering) on the

post not below the rank of junior Industries Inspector in the Government Department, Or

(2) Have about three years' experience in the field of Engineering or Technology (excluding civil Engineering) in any Local body or a Government under taking Board / Corporation or a Limited Company established by law in India or an Industrial Organization, on the post which is equivalent to or not below the rank of junior Industries Inspector in the Government Department recognized by Government as such," નો અનુભવ ધરાવતો હોવો જોઈએ. તદાનુસાર ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ અનુભવની લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 31.03.2017ના રોજ ધરાવતા હોવા જોઈએ.

5. આયોગની કચેરી દ્વારા તા.31.01.2018ના રોજની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં બિન અનામત (કોમન) વર્ગના બેઠક નંબર: 101000719 અને સા.શૈ.પ.વર્ગના બેઠક નંબર: 101001196 પરના ઉમેદવારોને અરજી ચકાસણી સમયે નિયત પ્રકારનો તથા પુરતો અનુભવ ધરાવતા ન હોઈ, રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવામાં આવેલ હતા.

6. આ ઉમેદવારોએ કરેલ રજૂઆતો અન્વયે બેઠક નંબર: 101000719 અને બેઠક નં.101001196 પરના ઉમેદવારોને તેઓનો અનુભવ માન્ય ગણી રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણતાં હવે આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ અનુસાર બિન અનામત (કોમન) વર્ગના ઉમેદવારોની કુલ 01 જગ્યા માટે નોર્મ્સ મુજબ 06 ઉમેદવારો અને સા.શૈ.પ.વર્ગ (કોમન) વર્ગના ઉમેદવારોની કુલ 02 જગ્યાઓ માટે નોર્મ્સ મુજબ 08 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવાના રહે છે.

7. આથી રૂબરૂ મુલાકાત માટે પાત્ર થયેલ બિન અનામત (કોમન) વર્ગની મેરીટ યાદીના છેલ્લા ક્રમાંકના બેઠક નંબર.101000713 પરના ઉમેદવાર હવે બિન અનામત (કોમન) વર્ગના રૂબરૂ મુલાકાત માટે નિયત લાયકી ધોરણ ધરાવતા ન હોઈ તેમજ સા.શૈ.પ.વર્ગ (કોમન) વર્ગની મેરીટ યાદીના છેલ્લા ક્રમાંકના બેઠક નંબર.101001124 પરના ઉમેદવાર હવે સા.શૈ.પ.વર્ગ (કોમન) વર્ગના

3

રૂબરૂ મુલાકાત માટે નિયત લાયકી ધોરણ ધરાવતા ન હોય અપાત્ર ગણી યાદી હેઠળની નોંધ (2): “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા ન હોય રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માં સમાવેશ કરવામાં આવે છે, તે સંખ્યા હવે 07 થશે, અને યાદી હેઠળની નોંધ (1) “આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.” માંથી બેઠક નંબર.101000719 અને બેઠક નંબર:101001196 પરના ઉમેદવારને બાકાત કરતાં આ સંખ્યા હવે 20 થાય છે. આયોગની કચેરી દ્વારા તા.31.01.2018ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010
તારીખ: 14.03.2018

Sd/-
સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ